



एक कदम स्वच्छता की ओर

નિવૃત્તિ આયોજન અને કર બચત

સરળ શબ્દોમાં, ઉજ્જવળ ભવિષ્ય માટેની બચતનું નિવૃત્તિનું આયોજન.

નિવૃત્તિ આયોજનનો સૌથી એક મહત્વનો ફાયદો-જ્યારે તમે તમારા ભવિષ્ય માટે બચત કરી રહ્યા છો ત્યારે તમે કર બચતનો લાભ આજે મેળવી શકો છો.

એનપીએસ કર લાભોના અનોખા મિશ્રણ સાથે આવે છે. કર લાભો પગારદાર અને સ્વ રોજગારી એમ બંને માટે ઉપલબ્ધ છે. કપાયેલ કર માટે દાવો કરવા માટે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ એનપીએસ એક લાયક સાધન છે.*

એનપીએસના પગારદાર કર્મચારીઓ માટે ફાયદાઓ

કરપાત્ર આવકમાથી પગારના (બેસિક+ડીએ) ૧૦% સુધીની કપાત - u/s 80 CCD (1) મહત્તમ રૂ. ૧ લાખ સમગ્ર ટોચમર્યાદા રૂ. ૧.૫૦ લાખ u/s 80 CCE* ની મર્યાદામાં.

સહુથી અગત્યનું, જો આપના નિયોક્તા જો આપના પેન્શન ખાતામાં ફાળવણી કરતા હોય, તો વધારાની ૧૦% કપાત પગારમાંથી (બેઝિક+ડી) u/s 80 CCD(2); આ મર્યાદા સમગ્ર ટોચમર્યાદા રૂ. ૧.૫૦ લાખ u/s 80 CCE* ની ઉપરાંત.

કોર્પોરેટ કર્મચારી માટેનું ઉદાહરણ		
(રકમ લાખ રૂપિયામાં)	માત્ર કર્મચારી પાસેથી એનપીએસ યોગદાન સાથે	કર્મચારી અને નિયોક્તા પાસેથી એનપીએસ યોગદાન સાથે
પગાર (બેઝિક+ડીએ)	૧૫.૦૦	૧૫.૦૦
ભથ્થાં	૩.૦૦	૧.૫૦
એનપીએસ સહ યોગદાન (પગારના ૧૦%)	-	૧.૫૦
કુલ પગાર	૧૮.૦૦	૧૮.૦૦
કુલ કપાત ૮૦ સીસીડી (૧) હેઠળ જો બચતદારનું ૧૦% યોગદાન એનપીએસ માટે હોય તો	૧.૦૦	૧.૦૦
નિયોક્તાના યોગદાન પર કપાત u/s ૮૦ સીસીડી (૨) હેઠળ	-	૧.૫૦
કરપાત્ર પગાર	૧૭.૦૦	૧૫.૫૦
કર (સરચાર્જ સહિત) એનપીએસ સાથે	૩.૪૫	૨.૮૮
ચૂકવવાપાત્ર કુલ ટેક્સ (સરચાર્જ સહિત) એનપીએસ વગર	૩.૭૬	૩.૭૬
એનપીએસમાં રોકાણ કરીને કર બચત	૦.૩૧	૦.૭૭


*Sections referred are from Income Tax Act, 1961, as amended from time-to-time.

**Tax Slabs for AY 2015-16



પેન્શન નિધિ વિનિયમક ઓર વિકાસ પ્રાધિકરણ
Pension Fund Regulatory and Development Authority
A Public awareness initiative on old-age income security

નિવૃત્તિ
માટેની બચતો ?



કર
માટેની બચતો ?

તમારા મનમાં એકની સરખામણીમાં અન્યનું પલ્લું ભારે છે ?

વિચાર કરો સંતુલિત દ્રષ્ટિકોણ પર
અપનાવો



એનપીએસ ની વધુ જાણકારી માટે નજીકના પીઓપી-એસપીને
ટોલ ફ્રી નંબર પર સંપર્ક સાધો

1800 110 708

અથવા

SMS

NPS to 56677*

*માનક શુલ્ક લાગુ

અથવા

અમારી વેબસાઇટની મુલાકાત લો

www.pfrda.org.in

એનપીએસના કોર્પોરેટ અને નિયોક્તા માટે કર ફાયદાઓ

તમે કોર્પોરેટ છો, જો તમે પોતાની માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, એસએમઇ, ખાનગી / જાહેર સાહસો, પીએસયુ અથવા એમએનસી વગેરે ધરાવો છો.

જો તમે કોર્પોરેટ તરીકે એનપીએસમાં તમારા કર્મચારી માટે યોગદાન કરો છો/આપો છો, તો તમે કર કપાતને ધંધાકીય ખર્ચ u/s 36 (i) iv (a)* પગારના ૧૦% સુધી સુધી દાવો કરી શકો છો.

એનપીએસના સ્વરોજગારી વ્યક્તિઓ માટે ફાયદાઓ

કરપાત્ર આવકમાથી કપાત - u/s 80 CCD (1) મહત્તમ રૂ. ૧ લાખ સમગ્ર ટોચમર્યાદા રૂ. ૧.૫૦ લાખ u/s 80 CCE* ની મર્યાદામાં.

NPS શું છે ?

જે વધુ સક્ષમ, ટેકનોલોજી આધારિત પ્રણાલી છે જેમાં સેકન્ડ ઇનિંગ માટેની બચત માટે ભંડોળ એકત્રી કરવા અત્યારથી થોડી થોડી બચતની શરૂઆત કરવામાં આવે છે.

NPS શા માટે ?

- ઓછી ખર્ચાળ યોજના છે.
- વ્યક્તિગત, કર્મચારીઓ અને નોકરીદાતાઓ માટે કર રાહત
- આકર્ષક બજારથી સંકળાયેલ વળતર
- સલામત, સુરક્ષિત અને સરળ રીતે સુવાહ્ય
- પેન્શન ફંડના અનુભવી નિષ્ણાતો દ્વારા વ્યવસ્થાપન
- કાયદા દ્વારા સ્થાપિત નિયમન કર્તા PFRDA દ્વારા નિયમન

કોણ જોડાઈ શકે છે ?

જો તમે નીચે દર્શાવેલ યોગ્યતા ધરાવો છો તો તમે જોડાઈ શકો છો :

- ભારતના નાગરિક - રહેવાસી કે બિન રહેવાસી
- જોડાતા સમયે ૧૮-૬૦ વર્ષની ઉંમર
- વેતન મેળવતા કે પોતાનો વ્યવસાય ધરાવતા હોવ

હું NPS ખાતું ક્યાં ખોલાવી શકું ?

PFRDA દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પેન્શન સુવિધા પૂરી કરનાર કેન્દ્ર (POP-SP)ની મુલાકાત લઈને.